Certified for PED Modules H & H1 by HSB IE Limited (NoBo # 2833) IBR Certified ASME "U" / "S' NATIONAL BOARD "NB" MEMBERS OF: HTRI-USA









29 May, 2023

To,

Bombay Stock Exchange Limited

Corporate Relationships Department 1st Floor, New Trading Ring, Rotunda Building, Phiroze Jeejeebhoy Towers, Dalal Street,

Mumbai - 400 001

BSE CODE: 523792

National Stock Exchange of India Limited

Exchange Plaza, C-I, Block G, Bandra Kurla Complex, Bandra (E) Mumbai - 400 051

NSE CODE: MAZDA

Subject: Newspaper Advertisement pertaining to Audited Financial Results for the Fourth Quarter and year ended on 31st March, 2023

Dear Sir,

Pursuant to Regulation 33 read with regulation 47(3) of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed newspaper publication of the extract of the Standalone Audited Financial Results of the company for the fourth quarter and year ended on 31st March, 2023, published in English and Gujarati language newspaper "Financial Express" on 27th May, 2023.

Please take note of the same.

Thanking you

Yours faithfully For Mazda Limited

Nishith Kayasth Company Secretary

Encl: As above

Works:

રકનપુર ગામ, તા. કલોલ, જુલ્લો ગાંધીનગર, ગુજરાત-૩૮૨७૨૨, ભારત. ફોનઃ ૦૨७૬૪-૨૮૬૩૨૩/૨૪. CIN: L27100GJ1993PLC020552 **จัดลเฮะ:** www.shilpgravures.com **ฮ-มิฮต:** cs@shilpgravures.com

નોટિસ (કંપનીના ઈક્વિટી શેર્સ ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (IEPF) માં તબદિલ કરવા બાબત)

આ નોટિસ ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરીટી (એકાઉન્ટીગ, ઓડીટ, ટ્રાન્સફર એન્ડ રીફન્ડ) રૂલ્સ ૨૦૧૬ (નિયમો) અન્વયે પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ નિયમોમાં, અન્ય બાબતો ઉપરાંત, એવા બધાજ શેર્સ કે જે શેર્સ ઉપર સતત સાત વર્ષો સુધી ડીવીડન્ડ ચૂકવાયું નથી કે શેરધારક દ્વારા માંગણી કરાઈ નથી તે ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (IEPF) નાં ડીમેટ ખાતામાં તબદીલ કરવાની જોગવાઈ છે.

નિયમોમાં નિર્ધારિત વિવિધ આવશ્યકતાઓનું પાલન કરતા, કંપનીએ જેમના શેર આ નિયમો અન્વયે IEPF ડીમેટ ખાતામાં તબદિલ કરવાપાત્ર થાય છે તે લગતા વળગતા બધા જ શેરધારકોને વ્યક્તિગત રીતે યોગ્ય કાર્યવાહી કરવા જાણ કરી છે. કંપનીએ આવા શેરધારકોની વિગતો જેવી કે નામ અને ફોલીયો નંબર/ડીપી આઈડી, ક્લાયન્ટ આઈડી કંપનીની વેબસાઈટ https://www.shilpgravures.com ઉપર મકેલ છે. માંગણી નહીં કરાચેલ ડીવીડન્ડની વિગતો કંપનીની વેબસાઈટ https://www.shilpgrayures.com પર ઉપલબ્ધ છે. શેરધારકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ વિગતોને ચકાશે અને તેમના માંગણી નહીં કરાયેલ ડિવિડન્ડનો

જેમના શેર્સ IEPF ડીમેટ ખાતામાં તબદીલ થવા પાત્ર છે તેવા શેરધારકોએ નોંધ લેવી કે તેમના શેર્સ ફીઝીકલ કે ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં, કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા સમયાંતરે સૂચિત પ્રક્રિયા અનુસાર IEPF ડીમેટ ખાતામાં સ્થળાંતરિત કરવામાં આવશે. ફીઝોકલ સ્વરૂપમાં શેર્સે ધરાવતા શેરધારકોના સંદર્ભમાં, IEPF ના ડીમેટ ખાતામાં શેર્સના સ્થળાંત૨ણ પછી, તેમના નામમાં નોંધાયેલા મૂળ શે૨ સર્ટીફીકેટો આપોઆપ રદ થઈ જશે અને બિન વાટાઘાટપાત્ર (નોન-નેગોશીયેબલ) માનવામાં આવશે. ડીમેટ સ્વરૂપમાં શેર ધરાવતા શેરધારકોના સંદર્ભમાં, કંપની IEPF ના ડીમેટ ખાતાની તરકેણમાં તેમના ડીમેટ ખાતામાં રહેલા શેર્સના ટાન્સકર માટે કોર્પોરેટ એક્શન દ્વારા સંબંધિત ડીપોઝીટરીને જાણ કરશે.

શેરધારકોએ વધુમાં નોંધ લેવી કે કંપનીએ પોતાની વેબસાઈટ ઉપર મૂકેલી વિગતો કંપની દ્વારા નિયમો અનુસાર IEPF ડીમેટ ખાતામાં તબદીલ કરવા માટે અને નવા શેર સર્ટીફીકેટો જારી કરવા માટે પૂરતી નોટીસ તરીકે ગણાંશે.

જો તારીખ ૨૨.૦૭.૨૦૨૩ અથવા કંપની દ્વારા લંબાવવામાં આવેલી અન્ય તારીખ સુધીમાં સંબંધિત શેર ધારકો તરફથી કોઈ સુચના પ્રાપ્ત નહીં થાય તો નિયમોમાં કરાયેલી જોગવાઈના અનુપાલનમાં આ શેર્સ નિયત તારીખે તે નિયમોમાં આપેલી કાર્યપધ્ધતિ પ્રમાણે કંપનીના કોઈપણ પ્રકારની આગળની કાર્યવાઈ અથવા જવાબદારી વગર IEPF ડીમેટ ખાતામાં તબદીલ કરાશે.

શેર ધારકોએ નોંધ લેવી કે IEPF માં તબદીલ થયેલા, ન ચુકવાયેલા ડીવીડન્ડ અને શેર્સ અને તેમની ઉપર મળી શક્તા બધાજ લાભો, જો કોઈ હોય તો, સહીત નિયમ પ્રમાણેની કાર્ચપધ્ધતિ મુજબ IEPF ઓથોરીટી પાસેથી વેબ ફોર્મ IEPF-5 ભરીને પરત મેળવી શકશે.

જો શેરધારકોને આ વિષયમાં કે નિયમો અંગે કોઈ પ્રશ્ન હોય તો તેઓ કંપનીન રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટસ, લિન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રા.લિ., પમાં માળે, પ૦૬ થી ૫૦૮, અમરનાથ બીઝનેસ સેન્ટર-૧ (એબીસી-૧) ગાલા બીઝનેસ સેન્ટરની બાજુમાં, સેન્ટ ઝેવીચર્સ કોલેજ કોર્નર પાસે, ઓફ સી.જી. રોડ, એલીસબ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૬, ફોન: ૦૭૯-૨૫૪૬૫૧૭૯, ઇ-મેઇલ: iepf.shares@linkintime.co.in.

શિ**લ્પ ગ્રેવિચર્સ લીમીટેડ** વતી સહી/-**૨થળ:** ૨કનપૂર શ્રી હર્ષ હિરપરા તારીખઃ ૨૬.૦૫.૨૦૨૩ કંપની સેક્રેટરી



Regd. Office: NKM International House, 5th Floor, 178 Backbay Reclamation, Behind LIC Yogakshema Building, Babubhai Chinai Road, Mumbai - 400 020 Phone: +91 22 7967 9053 • E-mail: investor_relations@riil.in CIN: L60300MH1988PLC049019

INFORMATION REGARDING (A) THIRTY- FIFTH ANNUAL GENERAL MEETING AND (B) RECORD DATE FOR DIVIDEND

The Thirty-fifth Annual General Meeting ("AGM") of the Members of the Company will be held through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") on Monday, June 19, 2023 at 02:00 p.m. IST, in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with all applicable circulars on the matter issued by the Ministry of Corporate Affairs ("MCA") and the Securities and Exchange Board of India ("SEBI"), to transact the business set out in the Notice calling

The Notice of the AGM and the standalone and consolidated audited financial statements for the financial year 2022-23, along with Board's Report, Auditors' Report and other documents required to be attached thereto, will be sent electronically to those Members of the Company, whose e-mail address is registered with the Company / KFinTech / Depository Participant(s) / Depositories. The Notice of AGM and the aforesaid documents will also be available on the Company's website at www.riil.in and on the website of the Stock Exchanges, that is, BSE Limited ("BSE") and National Stock Exchange of India Limited ("NSE") at www.bseindia.com and www.nseindia.com, respectively, and on the website of Company's Share Transfer Agent, KFin Technologies Limited ("KFinTech"), at https://evoting.kfintech.com.

Manner of registering / updating e-mail address:

- (a) Members holding shares in physical mode, who have not registered / updated their e-mail address with the Company, are requested to register / update their e-mail address by submitting Form ISR-1 (available on the website of the Company www.riil.in) duly filled and signed along with requisite supporting documents to KFinTech at Selenium Tower B, Plot 31-32, Gachibowli, Financial District, Nanakramguda, Hyderabad 500 032.
- (b) Members holding shares in dematerialised mode, who have not registered / updated their e-mail address with their Depository Participant(s), are requested to register / update the same with the Depository Participant(s) where they maintain their demat accounts.

Manner of casting vote(s) through e-voting:

Members can cast their vote(s) on the business as set out in the Notice of the AGM through electronic voting system ("e-voting"). The manner of voting, including voting remotely ("remote e-voting") by Members holding shares in dematerialised mode, physical mode and for Members who have not registered their email address has been provided in the Notice of the AGM. Members attending the AGM who have not cast vote(s) by remote e-voting will be able to vote electronically ("Insta Poll") at

Joining the AGM through VC / OAVM

Members will be able to attend the AGM through VC / OAVM, through JioMeet, at https://jiomeet.jio.com/riilagm. The information about login credentials to be used and the steps to be followed for attending the AGM are explained in the Notice of AGM

RECORD DATE FOR DIVIDEND AND PAYMENT THEREOF

- (a) The Company has fixed Monday, June 12, 2023 as the 'Record Date' for determining entitlement of Members to dividend, recommended by the Board of Directors of the Company, for the financial year ended March 31, 2023
- (b) The dividend will be paid within a week from the conclusion of the AGM, to the Members whose names appear on the Company's Register of Members as on the Record Date, and in respect of the shares held in dematerialised mode, to the Members whose names are furnished by National Securities Depository Limited and Central Depository Services (India) Limited as beneficial owners as on the
- (c) Payment of dividend shall be made through electronic mode to the Members who have registered their bank account details with the Company. Dividend warrants/ demand drafts will be dispatched to the registered address of the Members who have not registered their bank account details

Manner of registering mandate for receiving Dividend:

Members are requested to register / update their complete bank details

- (a) with their Depository Participant(s) with whom they maintain their demat accounts, if shares are held in dematerialised mode, by submitting forms and documents as may be required by the Depository Participant(s); and
- (b) with KFinTech by submitting duly filled and signed Form ISR-1 along with requisite supporting documents at its aforesaid address, if shares are held in

Members are requested to carefully read the Notice of the AGM and in particular, instructions for joining the AGM, manner of casting vote through remote e-voting or voting at the AGM.

By order of the Board of Directors

Amitkumar Mundhe Place: Mumbai Company Secretary and Dated: May 27, 2023 Compliance Officer

www.riil.in

TATA MOTORS LIMITED

Registered Office: Bombay House, 24, Homi Mody Street, Mumbai - 400 001. Website: www.tatamotors.com F-mail: inv. rel@tatamotors.com Corporate Identification No. (CIN) - L28920MH1945PLC004520

Notice

NOTICE IS HEREBY GIVEN pursuant to SEBI Circular No. SEBI/HO/DDHS/DDHS/CIR/P/2019/115 dated October 22, 2019 and FAQs for Listing of Commercial Papers (CPs) that the Record and Redemption of Commercial Papers issued and listed on Wholesale Debt Market Segments of National Stock Exchange of India Limited have been fixed as under:

ISIN of Security	Security Description	Listed on	Record Date	Redemption Date
INE155A14SS1 (CP 597)	₹500 crore. Date of Maturity: July 31, 2023	NSE	July 30, 2023	July 31,2023
INE155A14ST9 (CP 598)	₹200 crore. Date of Maturity: August 23, 2023		August 22,2023	August 23,2023

For Tata Motors Limited Maloy Kumar Gupta

Mumbai May 26, 2023

Company Secretary



Paid-up equity share capital (Face Value of ₹ 10 per share)

Other Equity excluding Revaluation Reserve

Basic and Diluted Earnings per share of ₹10/- each

THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2023 **Quarter Ended** Year Ended **Particulars** 31/03/2023 | 31/12/2022 | 31/03/2022 | 31/03/2023 | 31/03/2022 Audited Unaudited Audited Audited Audited Total Income from operations 6690.24 4331.04 5221.18 19151.88 16499.36 Net Profit / (loss) from ordinary activities before tax, 1462.85 3572.23 2764.95 exceptional or extra-ordinary items 3 Net Profit / (loss) from ordinary activities after tax 1062.63 660.90 785.11 2662.64 2124.39 2662.64 2124.39 785.1 Net Profit / (loss) for the period after tax 1062.63 660.90 (after extraordinary items) Total Comprehensive Income for the period 1087.67 645.83 727.12 2672.04 2100.53 [comprising profit / (loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]

400.50

26.53

Note: (i)The above is an extract of the detailed format of Quarterly and yearly audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of Audited Financial Results for the quarter and year ended 31/03/2023 are available on the Stock Exchanges website i.e. www.bseindia.com and nseindia.com as well as on the Company's Website i.e. www.mazdalimited.com.

ii)The aforesaid financial results were placed before and reviewed by the Audit Committee at its meeting held on 25/05/2023 and approved by the Board of Directors at its meeting held on the same date.

FOR & ON BEHALF OF THE BOARD OF MAZDA LIMITED PERCY AVARI

400.50

400.50

400.50

53.04

400.50

18189.74 16002.30

PLACE : AHMEDABAD WHOLE-TIME DIRECTOR DATE : 25/05/2023 DIN:00499114



GUJARAT ROAD AND INFRASTRUCTURE COMPANY LIMITED Registered Office: Office of the Secretary, Roads & Buildings Department, Block 14, Second Floo CIN: U65990GJ1999PLC036086 Sachivalaya, Gandhinagar - 382 010

			Quarter Ende	d	Year E	inded
Sr. No.	Particulars	March 31, 2023 (Audited)	Dec. 31, 2022 (Unaudited)	March 31, 2022 (Audited)	March 31, 2023 (Audited)	March 31, 2022 (Audited)
1.	Total Income from Operations	16,192	7,832	6,542	38.006	22,759
2.	Net Profit / (Loss) for the penod (before Tax. Exceptional and/or Extraordinary items)	12,897	5,480	3,883	27,601	11,713.
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	12,897	5,480	3,883	27,601	11,713
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	9,115	3,881	3,468	19,524	10,798
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	9,111	3,881	3,473	19,521	10,800
6.	Paid up Equity Share Capital	5,546	5,546	5,546	5,546	5,546
7.	Reserves (excluding Revaluation Reserve)	54,603	45,492	40.628	54,803	40,628
8.	Net worth	60,149	51,039	46,175	60,149	46,175
9.	Paid up Debt Capital / Outstanding Debt	13,302	14.537	15.740	13,302	15,740
10.	Debt Equity Ratio	0.22	0.29	0.35	0.22	0.35
11.	Basic and diluted earnings per share (EPS) (Face value of INR 10/- each) (not annualised for the quarters)					117.1
	- Basic	16.44	7.00	6.25	35.20	19,47
	- Diluted	16.44	7.00	6.25	35.20	19,47
12.	Capital Redemption Reserve	3,500	3,500	3,500	3.500	3,500
13.	Debenture Redemption Reserve	1,350	1,475	1,600	1,350	1,600
14.	Debt Service Coverage Ratio	7.85	15.06	2.56	7.01	3,14
42	Internal Combas Decreases Dalla	20.63	45.00	0.04	37 40	7.50

15. Interest Service Coverage Ratio Interest Service Coverage Ratio 29.63 15.06 9.94 17.48 7.50
NOTES TO THE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2023 The above is an extract of the detailed format of quarterly and annual financial results filed with the Stock Exchanges under Regulation 52 of the Listing Regulations. The full format of the quarterly and annual financial results are available on the websites of the Stock Exchange - National Stock Exchange (National Stock Exchange). The Stock Exchange - National Stock Exchange -

pany's website www.gricl.com

For the items referred in the Regulation 52 (4) of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015 (as amended), the perlinent isures have been made to the Stock Exchange (NSE) and can be accessed on the (www.nseindia.com) and on the Company's website www.gricl.com The figure of last quarter are balancing figures between audited figures of the full financial year ended March 31, 2023 & March 31, 2022 and unaudited published year to date figures upto December 31, 2022 & December 31, 2021 respectively, being the date of the end of the third quarter of the financial year



એક્સીસ બેન્ક લિમીટેડ સીઆઈએનઃ એલદ્પ૧૧૦જીજે૧૯૯૩પીએલસી૦૨૦૭૬૯ રજીસ્ટર્ડ ઓફ્સિઃ "ત્રિશુલ", ત્રીજો માળ, સમર્થેશ્વર મંદિર સામે, લો ગાર્ડન એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬, ગુજરાત देवीक्रोन नंः +६९७६-६६३० ६९६९ क्षेत्र्स नंः +६९७६-२६४० ६३२९ ย์มิย์สะ shareholders@axisbank.com จัดสเย็ะ: www.axisbank.com

બેંકના શેર ધારકોને નોટિસ

વિષયઃ એક્સિસ બેન્ક લિમિટેડના નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માટેના દાવો ન કરાચેલા ડિવિડન્ડ અને નીચે દર્શાવેલ ઈક્વિટી શેર્સને ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટીને ટ્રાન્સફર કરવા.

સંદર્ભઃ કંપનીઝ એક્ટ, ૨૦૧૩ની કલમ ૧૨૪ અને ૧૨૫ તથા ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી (એકાઉન્ટીગ, ઓડિટ, ટ્રાન્સફર અને રિફંડ) રૂલ્સ, ૨૦૧૬, સંશોધિત મુજબ.

આથી અહી એક્સિસ બેન્ક લિમિટેડના (બેન્ક) શેરધારકોને નોટિસ આપવામાં આવી રહી છે કે કંપનીઝ એક્ટની કલમો ૧૨૪ અને ૧૨૫ અને નિયમ ૬(૩)(એ) ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી (એકાઉન્ટીંગ, ઓડિટ, ટ્રાન્સફર અને રિફંડ) નિયમો, ૨૦૧૬, (આઈઈપીએફ રૂલ્સ) સંશોધિત નિયમો અન્વયે બેન્કને સતત સાત વર્ષના સમયથી દાવો ન કરાચેલા કે ન ચુકવાચેલા ડિવિડન્ડના સંદર્ભમાં ઈક્વિટી શેર્સ આઈઈપીએફ ઓથોરિટીના ડિમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફરની છેલ્લી તારીખથી ૩૦ દિવસમાં ટ્રાન્સફર કરવાના છે.

આઈઈપીએફ નિયમો અનુસાર, બેન્કે સંબંધિત શેરધારકોને બેન્કના રજિસ્ટ્રાર એન્ડ શેર ટ્રાન્સફર એજન્ટ (આરટીએ) કેફિન દેકનોલોજીસ લિ. (કેફિર્ન), પાસેથી તેમના રજિસ્ટર્ડ સરનામે, જેમના ડિવિડન્ડ સતત સાત વર્ષના સમયથી ચૂકવાયા નથી કે તેનો દાવો કરાયો નથી તેમને ૧૨ ઓગસ્ટ. ૨૦૨૩ ના રોજ કે તેની પહેલા તેનો દાવો કરવા માટે સલાહ આપતા પત્રો મોકલ્યા છે જેમાં નિષ્ફળ રહ્યે બેન્ક નાણાકીચ વર્ષ ૨૦૧૫-૧૬ માટેના દાવો ન કરાચેલા ડિવિડન્ડ તથા બેન્કના સંબંધિત ઈક્વિટી શેર આઇઇપીએફ ઓથોરિટીને નિયમો અનુસાર, છેલ્લી તારીખ ૨૮ ઓગસ્ટ, ૨૦૨૩ના દિવસે અથવા તે પછી ટ્રાન્સફર કરવા માટે આગળ કાર્ચવાહી કરશે.

ઝા ઉપરાંત બેન્ક હારા જેમના ઈક્વિટી શેર્સ આઈઈપીએફ ઓથોરિટીને ઉપર જણાવ્યા પ્રમાણે ટ્રાન્સફર કરવાને પાત્ર છે એવા સંબંધિત શેરધારકોની વિગતો બેન્કની વેબસાઈટ <u>www.axisbank.com</u> પર શેર હોલ્ડર્સ કોર્નર -> ઈન્વેસ્ટર્સ એફ્એક્યૂઝ-> 'લિસ્ટ ઓફ શેરહોલ્ડર્સમાં દાવો ન કરાચેલા સંબંધિત શેર અને ડિવિડન્ડને ટ્રાન્સફર કરવા માટે મૂકવામાં આવી છે'.

મેન્કના એવા સંબંધિત શેરધારકો કે જેમની પાસે બેન્કના ઈક્વિટી શેર્સ ફિઝિકલ ફોર્મમાં છે અને તે આઈઈપીએફને ટ્રાન્સફર કરવાને પાત્ર છે, તેઓ એ નોંધ લેવી કે બેન્ક આવા ઈક્વિટી શેર આઈઈપીએફ ઓથોરિટીને ટ્રાન્સફર કરવા માટે શેર સર્ટિફિકેટ ઈસ્ચુ કરશે, શેરધારકો પાસે રહેલા ઓરિજિનલ શેર સર્ટિફિકેટની અવેજીમાં અને આ બોબત અંગે, બેન્ક ડિપોઝીટરીઝને કોર્પોરેટ એક્શન હારા ડિમેટ ફોર્મમાં પરિવર્તિત કરવા અને તેને આઈઈપીએફ ઓથોરીટીની તરફેણમાં ટ્રાન્સફર કરવા માટે જાણ કરશે. ઓરિજિનલ શેર સર્ટિફિકેટ કે જે ઓરિજિનલ શેરધારકના નામે નોંધાયેલા છે તે આપોઆપ રદ થશે અને તે નોન-નેગોશિએબલ ગણાશે. સંબંધિત શેરધારકો કે જેઓ બેન્કના ઈક્વિટી શેર્સ ડિમટીરિચલાઈઝ્ડ સ્વરૂપમાં ધરાવે છે તેઓ નોંધ લે ે બેન્ક શેર્સને આઈઈપીએફ ઓથોરિટના ડિમેટ એકાઉન્ટની તરફેણમાં શેર ટ્રાન્સફર કરવા માટે કોર્પોરેટ એક્શનથી

૧૨ ઓગસ્ટ, ૨૦૨૩ સુધીમાં પોતાના ડિવિડન્ડનો દાવો ન કરનારા સંબંધિત શેરધારકોના કિસ્સામાં બેન્ક આઈઈપીએફના નિયમો અનુસાર, ઉપર[°] જણાવ્યા પ્રમાણે આઈઈપીએફને એવા શેરધારકોના ઈક્વિટી શેર્સ વધુ કોઈ નોટિસ આપ્યા વિના

નોંધ લેવી કે બેન્કે આઈઈપીએફ ઓથોરિટીને ટ્રાન્સફર કરેલા, દાવો ન કરાચેલા ડિવિડન્ડ અને ઈક્વિટી શેર્સ અંગે બેન્ક સામે કોઈ દાવો કરી શકાશે નહી. સંબંધિત શેરધારકોએ આવા ડિવિડન્ડ અને સંબંધિત ઈક્વિટી શેર્સ કે જે ટાન્સકર કરાયા છે તેના માટેનો દાવો, એવા ઈક્વિટી શેર્સને લગતા તમામ લાભ માટેનો દાવો આઈઈપીએફને કરવાનો રહેશે, જે પ્રક્રિયા આઈઈપીએફના નિયમો પ્રમાણેની નિર્દેશિત પ્રક્રિયાને આધીન રહીને કરી શકાશે.

ઉપરના મુદ્દે જો કોઈ સ્પષ્ટતા હોય તો શેરધારકોને અનુરોધ છે કે તેઓ કેફિન ટેકનોલોજીસ લિમિટેડના મેનેજર શ્રી સુરેશ બાબુ, ચુનિટઃ એક્સિસ બેન્ક લિમિટેડ, સેલનીયમ બિલ્ડીંગ, ટાવર બી, પ્લોટ ૩૧-૩૨, ફાઈનાન્સિયલ ડિસ્ટ્રીક્ટ, નાનકરામગુડા, સેરીલીંગ્મૃપલ્લી, હૈદરાબાદ, રંગારેક્રી, તેલંગાના, ઇન્ડિયા - ૫૦૦ ૦૩૨. ફોન નં. +૯૧ ૪૦-૬७૧૬ ૨૨૨૨, ઈમેઈલ આઈડી: <u>einward.ris@kfintech.com</u> પર સંપર્ક કરી શકે છે.

એક્સિસ બેંક લિ. વતી

ક્થળઃ અમદાવાદ તારીખઃ મે ૨૬, ૨૦૨૩

સંદિપ પોદાર કંપની સેક્રેટરી એસીએસ ૧૩૮૧૯ ફાયનાન્સિયલ એક્સપ્રેસ

क्रेनरा बैंक Canara Bank 📣

રીટેલ એસેટ હબ અમદાવાદ

ગ્રાઉન્ડ ફ્લોર, નિલકંઠ એવન્યુ ૧, સી યુ શાહ કોલેજ પાસે, આશ્રમ રોડ, 🚮 सिंडिकेट Syndicate અમદાવાદ ૩૮૦૦૧૪. ફોન : 079-27583018/19 ઈમેલ : cb3218@canarabank.com દેવાદાર ભાગીદારી પેઢીના સ્વર્ગસ્થ દેવાદાર/સ્વર્ગસ્થ ભાગીદારના કાનૂની વારસદારને નોટીસ

દેવાદારના કાનૂની વારસદારો સ્વ. અશ્વિનભાઇ એન. ચોવટીયા સી-૪૦૧, સિગ્નો૨, રાજરાજેશ્વરી પાછળ , કેનાલ રોડ , ઘોડાસર , અમદાવાદ-૩૮૦૦૫૦

વિષય : સિક્યોરીટાઈગ્રેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાબ્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩ (૨) હેઠળ ડિમાન્ડ નોટીસ.

રવ. અશ્વિનભાઈ એન. ચોવટીચાએ અમારી **ચાંદખેડા શાખા** પાસેથી , વખતો વખત નીચે મુજબની લોન્સ/ક્રેડિટ સુવિધાઓ મેળવી હતી. dl. **२८.०४.२०२**३ તા. ૨૮.૦૪.૨૦૨૩ बोन / મુજબ વ્યાજ અને મુજબ મુદ્દલ લોન નંબર મર્યાદાનો મુજબ કુલ અન્ય ચાર્જાસ જવાબદારી પ્રકાર હાઉસિંગ ૧૧.૫૦% 3२५०५१६००००८० 31. 31. (२%ना हरे લોન **9**6,8८,3८२.०० ૨,૧૯,૫૬૮.૮૬ ७१,५७,६५०.८५ પેનલ વ્યાજ

સહિત) **૧૧.૫**0% 2 3240539000008 હાઉસિંગ (२%ना हरे લોન 3,86,668.00 **e,eou.c3** 3,46,666.63 પેનલ વ્યાજ સિક્ચોર સહિત) इा.७२,६५,३५५.०० इा.२,२६,४७४.५६ इा.७२,२५,८३०.५६ ટોટલ

ઉપરોક્ત લોન્સ/ક્રેડિટ સુવિધાઓને નીચે યાદીમાં વિગતવાર જણાવેલ મિલકત ગીરો કરાવીને તેમના દ્વારા અમારી તરફેણમાં સંબંધિત ચોગ્ય દસ્તાવેજોની કાર્યવાહી કરીને સુરક્ષિત કરવામાં આવી હતી . તેઓ જણાવેલ શરતો અને નિયમો અનુસાર નાણાં ચૂકેવવામાં નિષ્ફળ ગયા હોવાથી બેંકે **તા. ર/૦૪/૨૦૨૩** ના રોજ તેમના **ખાતાને એનપીએ તરીકે** જાહેર કર્યું હતું. **અમને જાણવા મળ્યું કે દેવાદાર મૃત્યુ પામ્યા છે.** આથી અમે તમને કથિત એક્ટની કલમ ૧૩(૨) હેઠળ નોટીસ આપીને જણાવીએ છીએ કે દેવાદારના મૃત્યુ પછી તેમના/તેણીના કાનૂની વારસદાર તરીકે તમે દેવાદાર પાસેથી બેંકના ઉપાર્જિત અથવા લેણાં નીકળતી હાઉસીંગ લોનમાં **તા. ૨૯/૦૪/૨૦૨૩ મુજબની** રૂા. ७૧,૬७,૯૫૦.૮૬ (રૂપિયા ઇકોત્તેર લાખ સડસઠ હજાર નવસો પચાસ અને છચાંસી પૈસા) તરીકેની રકમ તા. ૨૯/૦૪/૨૦૨૩ થી આગળના વ્યાજ સહિત અને તા. ૨૮/૦૪/૨૦૨૩ મુજબની રૂા. ૩,૫७,૮७૯.૮૩ (રૂપિયા ત્રણ લાખ સત્તાવન હજાર આઠસો ઓગણએંસી અને ત્<mark>યાંસી પેસા) તરીકેની સ્કમ તા. ૨૯/૦૪/૨૦૨૩ થી આગળના વ્યાજ સહિત</mark> ચુકવવા અને તેમણે મંજૂર કરાયેલ મર્યાદા હેઠળ મેળવેલ ધિરાણ સુવિધાઓની સમગ્ર જવાબદારીઓ પૂરી કરવા ઉત્તરદાયી થયા છો તેથી, આ નોટીસની તારીખથી ૬૦ દિવસની અંદર દેવાદાર દ્ધારા મેળવેલ ધિરાણ જવાબદારીઓની ઉપર જણાવેલ સમગ્ર રકમ તમારે ચૂકતે કરી જવાની રહેશે, જેમાં કસૂર થવા પર બેંક કથિત

એક્ટની ક્લમ ૧૩(૪) હેઠળના કોઈપણ અથવા તમામ અધિકારનો ઉપયોગ કરેશે. ઉપરાંત, આપને બેંકની પૂર્વ મંજૂરી સિવાય શિડ્યુલમાં જણાવેલ સુરક્ષિત મિલકતનો કોઇપણ રીતે ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવે છે. આ અમેને કથિત એક્ટ દ્વારા ઉપલબ્ધ અને/અથવા પ્રવર્તમાન અન્ય કોઇપણ એક્ટ દ્વારા ઉપલબ્ધ કોઇપણ અન્ય અદ્યિકારના પૂર્વગ્રહ સિવાય છે.

સુરક્ષિત મિલકત છોડાવવા માટે ઉપલબ્ધ સમય અંગે સરફેસી એક્ટની કલમ ૧૩ ની પેટા-કલમ (૮) ની જોગવાઈઓ પ્રત્યે અમે આપનું ધ્યાન દોરીએ છીએ

આપર્ને આ ડિમાન્ડ નોટીસ શાખામાં ઉપલબ્ધ આપના છેલ્લા સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ એ .ડી . દ્વારા મોક્લવામાં આવી છે .

શિક્યુલ								
સિક્યુરીટી એસેટની વિગતો	સિક્યુરીટી એસેટની વિગતો							
ટાઈટલ હોલ્ડરનું નામ	સ્થાવર							
સ્વ.અશ્વિનભાઈ એન. ચોવટીચા	રજુસ્ટ્રેશન જુલ્લા અમદાવાદ અને ઉપ જુલ્લા અમદાવાદ-૧૨ (નિકોલ) માં તાલુકા અસારવાના મોજે નિકોલ ખાતે સ્થિત આશરે ૨૩૦૬૭ ચો.મી.માપના રેવેન્યુ સર્વે નં. ૫૧૮/૧, ટી.પી.સ્કીમ નં. ૧૧૧ ના આશરે ૧૩૮૪૦ ચો.મી.માપના ફાઇનલ પ્લોટ નં. ૧૪૧ ના આશરે ૧૩૮૪૦ ચો.મી.માપના ફાઇનલ પ્લોટ નં. ૧૪૧/૨ ઇરાવતી જમીન ઉપર બંધાચેલ સુવાસ કેસ્પીચા તરીકે જાણીતી બિલ્ડીંગ સ્કીમમાં કથિત જમીનના આશરે ૧૦૮.૧૨ ચો.મી.માપના અવિભાજીત હિસ્સાની સાથે બ્લોક નં. ડી ના ૧૧મા માળે આશરે ૨૮૦.૧૦ ચો.મી.માપના પેન્ટહાઉસ અને ૧૦મા માળે આશરે ૧૩.૨૯ ચો.મી.માપના બાલ્કની અને વોશ એરિચા સહિત આશરે ૨૬૬.૮૧ ચો.મી.માપના ફ્લેટ/એપાર્ટમેન્ટ નં. ૧૦૦૪ તરીકેની સ્થાવર મિલકત. ચતુઃસીમાઃ પૂર્વઃ કમ્પાઉન્ડ દિવાલ પછી કોમન ખુલ્લી જગ્યા, પશ્ચિમઃ ફ્લેટ/એપાર્ટમેન્ટ નં. ડી/૧૦૦૧ પછી કોમન ખુલ્લી જગ્યા, ઉત્તરઃ ફલેટ/એપાર્ટમેન્ટ નં.ડી/૧૦૦૩, દિશાલ પ્લોક નં.એ.							

અધિકૃત અધિકારી, કેનરા બેંક તારીખ : ૦૯.૦૫.૨૦૨૩, સ્થળ : અમદાવાદ

ભારતીય સ્ટેટ બેંક

સ્ટ્રેસ્ક એસેટ્સ મેનેષ્યેન્ટ શાળા, રજો માળ, પરમસિધ્ધિ કોમ્પલેક્ષ, વી.એસ. હોસ્પિટલ સામે, એલિસબીષ, અમદાવાદ-૩૮૦૦૦૬, ફોન્ન : ૦૦૯–૨૬૫૮૧૦૮૧, ફેક્સ : ૦૦૯–૨૬૫૮૧૧૩૦ ઇમેલ : sbi.04199@sbi.co.in, અધિકૃત અધિકારીનું નામ : શ્રી સુનિલ કી. રાચ્છ, મો. ૭૬૦૦૦૪૨૫૮૫

જંગમ અને સ્થાવર મિલકતોના વેચાણ માટે ઇ-હરાજી વેચાણ નોટી પરિશિષ્ટ-II-એ અને પરિશિષ્ટ-IV-એ (જૂઓ નિયમ ક(૨) અને ૮ (ક) ની જોગવાઇ)

सिक्योरीटी ग्रंबरेस्ट (खेन्होसीन्ट) नियमो, २००२ ना नियम ६(२) अने नियम ८(५) नी कोगवार्ष साथै वंशाता सिक्योरीटाग्रीश रिकन्स्ट्रक्यन ओह कृष्टनान्सियव छोरोट्स छोन्ड खेन्होरीनेट ओह रिक्योरीटी ग्रंबरेस्ट छोड्ट, २००२ ढेडण कंगम सने स्थापर विव વેચાણ માટે ઇ-હરાજી વેચાણ નોટીસ.

વેચાઇ માટે ક નુસાલુ વેચાઇ લોકીસ. આદી ભહેર જનાતો અને ખાસ કરીને દેવાદાસ(રો) અને જામીનદાસ(રો)/ડાયરેક્ટર્સ/પ્રમોટર્સ/ગીરવેદારો ને નોટીસ આપવામાં આવે છે કેં સુરક્ષિત લેઇદારને શિક્યુલ એ અને શિક્યુલ બો માં વર્ઇવીત હાઈપોથીકેટેડ કરાયેલ જંગમ અને ગીરો/ચાજર્ડ કરાયેલ સ્થાવર મિલકતો, જેનો પ્રત્યક્ષ/સાંકેતિક કળજે ભારતીય સ્ટેટ બેંક, સુરક્ષિત લેઇદારના અદિકૃત અદિકારીએ વઈ લીધો છે, તેમને સુરક્ષિત લેઇદારના તા. ૧૯.૦૪.૧૦૧૩ મુજબા ગ્રુ. ૧૯૮.૧૩ કરોડ વવા તેની પરના વ્યાજ, પડતર, ખર્ચાઓ બાદ તે પછી કરાયેલ વસૂલાત, જે હોય તો તરીકેના બાકી લેઇ!ની વસૂલાત મે. રાજ કંબ્દરનેશનનલ ઉત્ત (દેવાદાર) અને (૧) ચી જગદીશ છે. બોઢા (કાયરેક્ટર), (૨) શ્રી રાજેશકૃષ્ણર અરુપ્ય લેક્સી (કાયરેક્ટર), (૩) શ્રી તુષ્ણર સાલ (કાયરેક્ટર), (૪) શ્રીમતી સંત્રીતા જગદીશ બોઢા (કાયરેક્ટર), (૫) એસવીએસ દેશ એ ફેબ પ્રા. ઉત્ત (કોપોરેટ જામીનદાર), (૬) રાજ ઇન્ફારપેસ ગુજરાત પ્રા. ઉત. (કોપોરેટ જામીનદાર), (૦) રાજ ફેબટેસ ગુજરાત પ્રા. ઉત. (કોપોરેટ જામીનદાર), (૮) માર. વે. સ્કર્વર લિંક પ્રા. ઉત. (કોપોરેટ જામીનદાર), (૬) શ્રીપતી સંગતા અત્ર. લેકરીયા (જામીનદાર), (૧૦) શ્રીમતી વિજયાણેન અશોક જગાણી (જામીનદાર) પાસેલી કરવા માટે જ્યાં છે ત્યાં, જે છે તે, ત્યાં જે કાંક છે તેના દોશ તા. ૧૦.૦૦.૨૦૨૩ ના રોજ વેચવામાં આવશે. બિડર્સ હરાજના તારોખ અગાઉ મે. એમએસ્ટીસી લિ. દ્વારા અનસરાયમાં સ્થાતી પ્રસ્તા મારે ભળ આવશક ફેવાસ્ટ્રી દરતાવેજે અને રજાસ્ટ્રેશન કી બિડર્સે હરાજીની તારીખ અગાઉ મે. એમએસટીસી લિ. દ્વારા અનુસરવામાં આવતી પ્રક્રીયા મુજળ આવશ્યક કેવાયસી દસ્તાવેજો અને રજીસ્ટ્રેશન ફી પ્રદાન કરાવવા દ્વારા www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp ઉપર તેમની પોતાની નોંધણી કરાવવાની રહેંશે

રિઝર્વ ર્કિંમત અને અર્નેસ્ટ મની ડિપોઝીટ નીચે મુજબ રહેશે . જાહેર ઇ-હરાજીની તારીખ અને સમય : ૧૬.૦૬.૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક થી બપોરે ૦૪.૦૦ કલાક સુધી પ્રત્યેક ૧૦ મિનિટના અમચાદિત વધારા સહિત

પ્લાન્ટ અને મક	शीनरी : शिडर्	હ્લ - એ			(25H 31. HÌ
લોટ ને.	भिवडतनी विञंत	રીઝર્થ કિંમત (જ્ઞા.) માં	અનેંસ્ટ મની માં (ગા) સીલીવીટ	લીક વૃદ્ધિમાં વધારો (રૂપ.) માં	निरीक्षणनी दावीन अने समय
SBIN 1000VM582100	खाद्ध को भशीवती : टा॰ ઇन्टरनेशनल હि. थीं संअंधित अंडना नाशांसांथी भरीहायेल कमारा आंडेतिक कदम्ब हैडकानी सर्वें नं. ६६, गाम वस्थागेडी, ताबुडा माणीथा, सुखा टा॰डोट भाते तेनी तमाम कोसेक्शीफ सर्वित 2.10 MW, VM 58 जी विन्ड मितनुं हार्गपोथीडेशन.	8,50,00,000/-	85,00,000/-	1,00,000/-	12.09.2043 QIVIÈ 02.00 III QIVIÈ 03.00
SBIN 1000PB780600	પ્લાન્ટ અને મશીનથી : રાજ ઇન્ટરનેશનલ હિ. થી સંબંધિત બેંકના નાણાંમાંથી ખરીદાચેલ અમારા સાંકેલિક કલ્મના હેઠળની સર્વે નં. ૧૧૧૯, ખીમેશ્વર મહાદેવ મંદિર પાસે, ફુછડી બીચ, ગામ ફુછડી, તાલુકા પોરબંદર, જીલ્લા પોરબંદર ખાતે તેની તમામ એસેસ્સીઝ સહિત D.60 MW, P - 78 ની વિન્હ મિલનું હાઇપોથીકેશન.	- C. C.	13,00,000/-	40,000[-	૧૩.૦૬.૨૦૨૩ સવારે ૧૧.૦૦ શ્રી હાયોરે ૧૨.૦૦

शिड्युल - जी સ્થાવર મિલકતો रीजर्प सिमत कार्ज्य अजी व्यक्तिमां નિરીકા**છા**ની विषद्भवनी विभव વધારો (રૂા.) માં (31.) Mi ांभ (अ) अस्तिभिक्ष तारीण सने सम कोमर्शियस मिसकतः अभारा प्रत्यक्ष कलक 6505.20.30 હેંહળના રાજ ઇન્ફારપેસ ગુજરાત પ્રા. લિ. લી સંબંધિત લોક દોક રોક, અઠવાલાઇન્સ, સુરત ખાતે 43, 40,000/-9,38,00,000 oruja 02.00 SBIN વેચાણ ખત મુજબ સિટી સર્વે નોંધ નં. ૨૩૨૨, ૨૩૨૩ અને ૨૩૨૫/એ, ટી.પી.સ્ક્રીય નં. ૫ (અઠવા-ઉમરા), એક્પી.નં. ૧૧૦/એ પાર્ટ ઘરાતતા **યુનિયન પોર્કન્ટ, સુરતના એ લ્લોક**ના ૨૮૩.૯૨ ચો.મી.ને સમાંતર ૩૦૫૫.૦૦ ચો.ફીટ માપના સુપર બિલ્ટ અપ એરિયા અને તેના ૧૭૦.૩૫ ચોરસ મીટર્સ ને સમાંતર ૧૮૩૩.૦૦ ચોરસ ફીટ કાર્પેટ એરિયા ધરાવતા બંધાયેલ **મકાન નં. ૩, બીજા માળે (દકાન ટાઈપ) શોરૂમ**. कोमर्शियस मिसकतः अभारा प्रत्यक्ष क्रमण 6505.2023 હેઠળના રાજ ઇન્ફારપેસ ગુજરાત પ્રા. લિ. થી સંબંધિત ઘોડ દોડ રોડ, અઠવાલાઇન્સ, સુરત ખાતે 15.40.000/-2,54,00,000/ **अपोर्ड ०२.००** ત્રેચાણ ખત મુજબ સિટી સર્વે નોંધ નં. ૨૩૨૨, ૨૩૨૩ SBIN

અને ૨૩૨૫/એ, ટી.પી.સ્કીમ નં. ૫ (અઠવા-ઉમરા), એક્.પી.નં. ૧૧૦/એ પાર્ટ ઘરાવતા **યુનિયન પોઇન્ટ, સુરતના** એ લ્લોકના ૨૮૩.૯૨ શો.મી.ને સમાંતર ૩૦૫૫.૦૦ થો.ફીટ માપના સુપર બિલ્ટ અપ એરિયા અને તેના ૧૭૦.૩૫ ચોરસ મીટર્સ ને સમાંતર ૧૮૩૩.૦૦ ચોરસ ફીટ કાર્પેટ એરિયા ધરાવતા બેંધાયેલ મહાન નં. ૩, ૩૧૧ માળે આગળની બાજુ क्षेत्रशियस मिसकतः समारा प्रत्यक्ष कराजा 6505.2023

હેઠળના રાજ ઇન્ફારપેસ ગુજરાત પ્રા. લિ. થી સંબંધિત ઘોડ દોડ રોડ, અઠવાલાઇન્સ, સુરત ખાતે 40,000/-લયોરે ૦૧,૦૦ થી 4,54,00,000/ 25,40,000/-OUIZ 02.00 રેચાણ ખત મુજબ સિટી સર્વે નોંધ નં. ૨૩૨૨, ૨૩૨૩ SBIN અને ૨૩૨૫/એ, ટી.પી.સ્કીમ નં. ૫ (અડવા-ઉમરા), એફ.પી.નં. ૧૧૦/એ પાર્ટ ઘરાવતા **યુન્યન પોઇન્ટ, સુરતના એ લ્લોક**ના ૨૮૩.૯૨ ચો.મી.ને સમાતર ૩૦૫૫.૦૦ ચો.કીટ માપના સુપર બિલ્ટ અપ એરિયા અને તેના ૧૭૦.૩૫ ચોસ્સ મીટર્સ ને સમાંતર ૧૮૩૩.૦૦ ચોસ્સ ફીટ કાર્પેટ એરિયા ધરાવતા ગંધાયેલ **મકાન નં. ૩, ૪૦૫ માળે આગળનં** ભાજુ (દુકાન ટાઈપ) શોરૂમ.

04.05.2033 હેઠળના રાજ ઈન્ફાસ્પેસ ગુજરાત પ્રા. લિ. લી સંબંધિત લોડ દોક રોક, અઠવાલાઈન્સ, સુરત ખાતે 1,36,00,000/-23.60,000/-લપોરે ૦૧.૦૦ થી 00.50 filmo વેચાણ ખત મુજબ સિટી સર્વે નોંધ નં. ૨૩૨૨, ૨૩૨૩ અને ૨૩૨૫/એ, ટી.પી.સ્કીમ નં. ૫ (અઠવા-ઉમરા), એફ.પી.નં. ૧૧૦/એ પાર્ટ ઘરાવતા **યુનિયન પોઇન્ટ, સુરતના એ બ્લોક**ના ૨૩૮.૮૫ ચો.મી.ને સમાંતર ૨૫૭૦.૦૦ ચો.કીટ માપના સુપર બિલ્ટ અપ એર્ડિયા અને તેના ૧૪૩.૩૧ ચોસ્સ મીટર્સ ને સમતિર ૧૫૪૨.૦૦ ચોસ્સ ફીટ કાર્પેટ એરિયા ઘરાવતા બંધાયેલ **મક્ષન નં. ૪, ૪થા માર્તે આગળની બાજુ**

(દુક્તાન ટાઈપ) શોરૂમ. કોમર્શિયલ મિલકતઃ અમારા પ્રત્યક્ષ કઠાજ હેઠળના રાજ ઇન્ફારોસ ગુજરાત પ્રા. હિ. થી સંબંધિત ઘોડ દોડ રોડ, અઠવાલાઇન્સ, સુરત ખાતે વેચાથ ખત મુજબ સિટી સર્વે નોંધ નં. 69,00,000/-6,90,000/-ભાગેરે ૦૧.૦૦ થી 00.50 Elino

00286476 ર૩૨૨, ૨૩૨૩ અને ૨૩૨૫/એ, ટી.પી. સ્કીમ નં. ૫ (અઠવા-ઉમરા), એફ.પી.નં. ૧૧૦/એ પાર્ટ ઘરાવતા ચુનિયન पोर्डन्टनी पूर्व तरह महान नं. ३, पाछणनी लालु **युनियन पोर्डन्ट, सुरतना जी ०दोरू**न। तेना १०६, ररहट योरस मीटर ने समांतर १९४३.०० योरस हीट हापेंट सेरिया धरावता जंधाये**त भढान नं. ३, योद्या भाजे पाछणनी** ભાજુ (દુકાન ઢાઈપ) શોરૂમ. અમારા **પ્રત્યક્ષ કલજા** હેઠળની શ્રી જગદીશ

5,04,00,000/-

50,40,000/-

ળોદ્રાની માલિકીની ગામઃ ઉમરા, સુરત શહેર, જીલ્લાઃ સુરતના રેવેન્યુ સર્વે નં. રપ અને ૨૬, ટી.પી. oruje os.oo 100000296858 સ્ક્રીમ નં. ૫ (ઉમરા-ઉત્તર), એફ.પી.નં. ૧૨૧ અને ૧૨૨ ઘટાવતી જમીન ઉપર સ્થિત **રઘવીર પ્લોટ**માં આશરે ૪૫૦.૦૦ યો મી . માપના **પ્લોટ નં. ક** ની જમીન અને બિલ્ડીંગના તે તમામ પીસ અને પાર્સલ . **બોલાઓ**: અધિકૃત અધિકારીની શ્રેષ્ઠ ભાષકારી અને માહિતી અનુસાર, બેંકને કોઈ બોબની સલાક નથી. ઇચ્છુક બીડરોએ તેમની બીડ જમા કરાવતાં અગાઉ હરાજામાં યુકાચેલી મિલકતોના ટાઇટલ, બોબઓ અને મિલકતને અસર કરતા દાવાઓ/અધિકારો/બાકી લેવાં અંગે તેમની રીતે રવતુંત્ર તપાસ કરી લેવાની રહેશે. ઇ-હરાજુની બહેરાત બેંકની કોઈ પ્રતિબદ્ધતા અથવા બેંકના કોઈપછ પ્રતિનિધીત્વની રચના કરતી નથી અને કરે

અધિકૃત અધિકારી/શિક્યોર્ડ કેડિટર કોઇપણ રીતે કોઇપણ ત્રાહીત પાર્ટીના દાવાઓ/અધિકારો/બાકી લેળાં માટે જવાબદાર રહેશે નહીં. **બીંક સ્કર્મ** ઉપર અને ઉપરાંતના ઢીડીએસ/જીએસઢી/અન્ય વેરાઓ ખરીદનારે ભોગવવાના રહેશે. ચાછના વિગતવાર નિયમો અને શરતો માટે, કૃપા કરીને સિક્યોર્ડ ક્રેડિટર ભારતીય સ્ટેટ બેંકની વેબસાઇટ www.sbl.co.in, https://bank.sbl/ અને https://www.mstcecommerce.com/auctionhome/ibapl/index.jsp, https://ibapl.in માં અપાચેલ લિંકનો સંદર્ભ લેશો અથવા

છે એમ માનવામાં આવશે નહીં. મિલકતો ઈંકની જાણમાં હોય અથવા ન હોય તેવા હાલના અને ભવિષ્યના તમામ બોજાઓ રહિત વેચવામાં આવશે

એજીએમ/સીએલઓ નો મો. નં. હ્રદ૦૦૦૪૧૫૮૫ અને સીઓ નો મો.નં. ૯૭૦૪૫૫૯૨૬૧ નો સંપર્ક કરશો

આ નોટીસને સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ (એન્ટ્રોસમિન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૬(૨) અને ૮(૬) હેઠળ દેવાદાર/જામીનદારો/ગીરવેદારોને ૧૫ દિવસની નોટીસ તરીકે પણ ગણવાની રહેશે.

तारीभ : २७.०५.२०२३

નોંધ : વિવાદની સ્થિતીમાં આ નોઠીસનો અંગ્રેજ અનુવાદ માન્ય ગણવામાં આવશે.

કોમર્શિયલ મિલકતા અમારા પ્રત્યક્ષ કળજા

કરમશીભાઇ બોદ્રા અને શ્રીમતી સંગીતાબેન જે.

Gruit 03.00 all



Haldyn Glass Limited

Registered Office: Village Gavasad, Taluka Padra, Dist. Vadodara – Gujarat – 391 430 Tel: 02662242339, Fax: 02662 245081, E-mail: baroda@haldyn.com, Web: www.haldynglass.com

Statement of Financial Results For The Year Ended March 31, 2023

	DADTICIII ADS	STANDALONE			CONSOLIDATED						
Sr.	PARTICULARS	QUARTER ENDED		YEAR ENDED		QUARTER ENDED		YEAR ENDED			
No.				31.03.2022 (Unaudited)			31.03.2023 (Unaudited)		31.03.2022 (Unaudited)	31.03.2023 Audited	31.03.2023 Audited
1	Total Income	7,427.58	8,943.88	5,734.26	32,430.14	21,795.05	7,427.05	8,943.88	5,734.26	32,429.61	21,795.05
2	Profit from operations before share of profit/(loss) of joint										
	venture, exceptional items and tax	369.68	782.36	27.39	2,554.00	1,350.51	371.61	814.14	27.39	2,587.71	1,350.51
3	Share of profit / (loss) of joint venture	N/A	N/A	N/A	N/A	N/A	165.25	52.29	159.35	697.82	95.80
4	Profit before tax	369.68	782.36	27.39	2,554.00	1,350.51	536.86	866.43	186.74	3,285.53	1,446.31
5	Profit After Tax	489.48	498.25	145.64	1,969.53	1,086.60	656.28	573.24	304.99	2,691.60	1,182.40
6	Total comprehensive income for the period / year net of tax	458.13	533.24	191.19	1,945.41	1,153.98	607.24	628.06	352.84	2,669.62	1,262.30
7	Other Equity				18,243.69	16,585.76				17,188.55	14,806.41
8	Earning Per Share (face value of Re. 1 per share)										
	- Basic	0.91	0.93	0.27	3.66	2.02	1.22	1.07	0.57	5.01	2.20
	- Diluted	0.91	0.92	0.27	3.64	2.02	1.22	1.06	0.57	4.98	2.20
	tes: The above results are reviewed by the Audit Committee, have bee	n approved by	the Poord of C	Directors of the	Company at it	a Mooting hold	don May 25, 20	122		- 1	

1. The above results are reviewed by the Audit Committee, have been approved by the Board of Directors of the Company at its Meeting held on May 25, 2023.

Regd. Office: C/1-39/13/16 GIDC Naroda, Ahmedabad - 382 330

EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR

THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2023

Audited

6690.24

1462.85

1062.63

1062.63

1087.67

400.50

26.53

(in Lakins except EPS)

Year Ended

82.08 40.04

40.04

30.71

30.71

2161.50

225.81

0.07

0.07

82.08

61.23

61.23

2161.50

287.05

0.14

0.14

Note: (i)The above is an extract of the detailed format of Quarterly and yearly audited Financial Results filed with the Stock

Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of

Audited Financial Results for the quarter and year ended 31/03/2023 are available on the Stock Exchanges website i.e.

(ii)The aforesaid financial results were placed before and reviewed by the Audit Committee at its meeting held on 25/05/2023.

www.bseindia.com and nseindia.com as well as on the Company's Website i.e. www.mazdalimited.com.

31/03/2023 31/12/2022

Quarter Ended

Unaudited

4331.04

861.30

660.90

660.90

645.83

400.50

16.50

CIN: L29120GJ1990PLC014293

2. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with SEBI Circular No. CIR/CF/FAC/62/2016 dated 5th July, 2016. The full format of the Financial Results are available on the Stock Exchange website - www.bseindia.com and on the Company's website - www.haldynglass.com

Mumbai: May 25, 2023



Total Income from operations

(after extraordinary items)

PLACE : AHMEDABAD

Particulars

1 Total Income from Operations (net)

(before Tax, Exceptional and/or

3 Net Profit / (Loss) for the period before

4 Net Profit/(Loss)for the period after tax (after

oceptional and/or Extraordinary items)

5 Total Comprehensive Income for the

the period (after tax) and Other Comprehensive income (after tax)]

7 Reserves (excluding Revaluation

8 Earnings per share (of Rs. 5/- each) (for continuing and discontinued operations

(a) Basic EPS:

(b) Diluted EPS:

www.starlineps.com

rules issued thereunder.

Place : Surat.

8 of the said Rules.

Loan

Account

16632 & HHFRAJIPL

etc. from date mentioned below.

of time available, to redeem the secured assets

HHFRAJHOU210000 | Mr. Ghanshyam Ambabhai

Other Property: South-Passage and Stair;

Date: 25-05-2023

Reserve) as shown in the Audited

Balance Sheet of the previous year

period [Comprising Profit/(Loss) for

6 Paid up Equity Share Capital (Face value of Rs.5 each)

tax (after Exceptional and/or Extraordinary items):

2 Net Profit/(Loss)for the period

Extraordinary items)

Sr.

No.

DATE : 25/05/2023

exceptional or extra-ordinary items

Net Profit / (loss) for the period after tax

Total Comprehensive Income for the period

other Comprehensive Income (after tax)]

Other Equity excluding Revaluation Reserve

8 Basic and Diluted Earnings per share of ₹10/- each

No.

Particulars

Net Profit / (loss) from ordinary activities before tax,

Net Profit / (loss) from ordinary activities after tax

[comprising profit / (loss) for the period (after tax) and

6 Paid-up equity share capital (Face Value of ₹ 10 per share)

and approved by the Board of Directors at its meeting held on the same date.

STARLINEPS ENTERPRISES LIMITED

(CIN: L36910GJ2011PLC065141)

Reg. Off.: Shop - F/1, 1st Floor, Athwa Ark Shopping Centre, Opp. Yatim Khana, Athwa Gate, Surat-395001, Gujarat

Tel.: 0261-2600343, Email: info@starlineps.com, Website: www.starlineps.com

Extract of Standalone Audited Financial Results for the Quarter and Year Ended 31st March, 2023

22,46

22.46

17.19

17.19

2161.50

0.04

0.04

The above is an extract of the detailed format of audited Financial Results for the Quarter and year ended on 31.03.2023 filed with the Stock Exchange under Regulation

33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and yearly audited Financial Results is available on the

Stock Exchange website: www.bseindia.com and on the Company's Website:

2. The above financial Results have been reviewed by the Audit Committee and approved

 The results have been prepared in accordance with the Indian Accounting Standards (Ind AS) as prescribed under Section 133 of the Companies Act, 2013 read with relevant

Regd. Office: 09, Community Centre, Basant Lok, Vasant Vihar, New Delhi - 110057 Phone: 011 49267000, Toll Free Number: 1800 212 8800, Email: customer.care@herohfl.com Website: www.herohousingfinance.com | CIN: U65192DL2016PLC30148 Contact Address: Office 638-639, 6th Floor, Old Amarpali Cinema, Raiya Road, Rajkot,

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)

(As per Appendix IV read with rule 8(1) of the Security Interest Enforcement Rules, 2002)

the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act,

2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security

Interest (Enforcement) Rules, 2002, issued a demand notices as mentioned below catting upon the

Borrowers to repay the amount mentioned in the notice within 60 days from the date of the said notice. The borrower, having failed to repay the amount, notice is hereby given to the borrower, in particular

and the public, in general, that the undersigned has taken possession of the property described

herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with rule

The borrower, in particular, and the public in general, are hereby cautioned not to deal with the

property and any dealings with the property will be subject to the charge of the Hero Housing Finance

Limited, for an amount referred to below along with interest thereon and penal interest, charges, costs

The borrower's attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect

Description of Secured Assets/Immovable Properties: All that piece and parcel Residential Flat

No. 203, Situated on 2nd Floor having a Carpet area 49-24 Sq. Mtrs in the Residential-cum-Commercial Building namely "TRIMURTI TOWERS" constructed on the NA land area 827-74 Sq.

Mtrs of Plot No. 95 situated at Raikot Revenue Survey No. 411, 412 & 412/2/p, TPS No. 3, FP No. 92 City Survey ward No. 6, City Survey No. 2566 & 2567, Laxmi Nagar Main Road, Near Trishul Chowk

in Sub-Dist. & Regi. Dist. Rajkot in the State of Gujarat-360004, with common amenities written in

Title Document. Bounded By- North-Margin and Road; East-Terrace and Road; West- Parking and

HHFRAJHOU Mr. Hitesh Jitendrabhai Kadecha. 20/03/2023. Rs. 17.44.676/- 25/05/2023

Description of Secured Assets/Immovable Properties: All that piece and parcels of Residential

Flat No. I/3 on Ground Floor having a Built-up area 45-18 Sq. Mtrs (Carpet area 37-65 Sq. Mtrs) in

Block-I of the Residential Complex namely "SURYA PARK" constructed on the NA Plot No. 10

situated at Rajkot Revenue Survey No. 440-A-4, TPS No. 2, FP No. 332 & 333, City Survey Ward No.

15/2, City Survey No. 3997 in sub Dist. & Regi. Dist. Rajkot, Gujarat- 360001, with common

amenities written in Title Document. Bounded By- North-Flat No. 4; East: Flat No. 2; West: Margin

Name of Obligor(s)/

Legal Heir(s)/Legal

Representative(s)

Akbari, Mrs. Jayshree G

Akbari

22000021818 Mrs. Parul Hiteshbhai Kadecha as on date 16/03/2023

as, the undersigned being the Authorized Officer of the Hero Housing Finance Limited, unde

by the Board of Directors at their respective meetings held on 25th May, 2023.

Quarter Ended

22.41

22.41

16.13

16.13

2161.50

0.04

31-03-2023 31-12-2022 31-03-2022 31-03-2023 31-03-2022

(Audited) (Unaudited) (Audited) (Audited) (Audited)

7.68

7.68

5.35

5.35

2161.50

0.01

0.01

FOR STARLINEPS ENTERPRISES LIMITED

SHWETKUMAR KORADIYA

Chairman & Managing Director

DIN: 03489858

Date of Demand Date of Possession

(Constructive/

Physical)

25/05/2023

(Symbolic)

Notice/Amount as

per Demand Notice

20/03/2023, Rs.

25,55,870/- as on

date 16/03/2023

Sd/- Authorised Officer, For Hero Housing Finance Limited

HERO HOUSING FINANCE LIMITED

727.99 567.42 2045.59 1642.30



(₹ in Lacs except EPS)

Year Ended

Audited

16499.36

2764.95

2124.39

2124.39

2100.53

400.50

53.04

PERCY AVARI

DIN:00499114

WHOLE-TIME DIRECTOR

31/03/2022 31/03/2023 31/03/2022

Audited

19151.88

3572.23

2662.64

2662.64

2672.04

400.50

66.48

18189.74 16002.30

Audited

5221.18

1011.12

785.11

785.11

727,12

400.50

19.60

FOR & ON BEHALF OF THE BOARD OF MAZDA LIMITED

NOTICE OF LOSS OF SHARES OF HINDUSTAN UNILEVER LIMITED (Formerly Hindustan Lever Limited)

Regd. Off. Hindustan Unilever Limited, Unilever House, B D Savant Marg, Chakala, Andheri (East), Mumbai - 400 099 Notice is hereby given that the following share certificates have been reported as lost/misplaced and the Company intends to issue duplicate certificates in lieu thereof, in due course. Any Person who has a valid claim on the said shares should lodge such

claim with the Company at its Registered Office within 15 days hereof. No. of shares Certificate Distinctive Folio Name of the No. (Rs.1/-f.v) No.(s) No.(s) Shareholder 5278352 1159798981 HLL2959808 Shah Kantilal 200 Shah Ranjanben 9180 Shah Puspa Place: Ahmedabad Date: 27-05-2023

NEOGROWTH

M/S NEOGROWTH CREDIT PRIVATE LIMITED Registered office: #802, 08th Floor, Tower A. Peninsula Business Park, G.K. Marg,

Lower Parel, Mumbai-400013, CIN: U51504MH1993PTC251544

For and on behalf of the Board

Haldyn Glass Limited

T.N.SHETTY **Managing Director**

DIN: 00587108

(₹In lakhs)

POSSESSION NOTICE - (for immovable property) Rule 8-(1) Whereas, the undersigned being the Authorized Officer of M/s Neo Growth Credit Private Limited under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, a Demand Notice was issued by the Authorised Officer of the company to the borrowers / co-borrowers mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of M/s Neo Growth Credit Private Limited for an amount as mentioned herein under with interest thereon. "The borrower's attention is invited to provisions of subsection (8) of section 13 of the Act, If the borrower clears the dues of the "M/s Neo Growth Credit Private Limited" together with all costs, charges and expenses incurred, at any time before the date fixed for sale or transfer, the secured assets shall not be sold or transferred by "M/s Neo Growth Credit Private Limited" and no further step shall be taken by "M/s Neo Growth Credit Private Limited" for transfer or sale of the secured assets.

Name and address of the Borrower Guaranton/Mortgagor	Descripton of Secured Assets (Immovable Property)	Total Outstanding	Date of Demand Notice Date of Possession
Payal Boutiques, Payalben Alpeshkumar Bhavsar, Dushyant Ramchandra Bhavsar	All that Piece and Parcel of Property Bearing Flat No. A/SF/11 on 2nd Floor, admeasuring 55:18 Sq. mtrs. at & in Aakanksha Co-Operative Housing Society Limited Known As "Aakanksha Apartments" Constructed on land bearing final Plot No. 22, of Town Planinng Scheme No. 52, Revenue Survey No. 280 (Survey No. 280/1 As Per Plan), situated lying an being at Mouje Ghodasar, Taluka Maninagar in the district of Ahmedabad and Registration Sub District Ahmedabad-5 (Naroll), Gujarat-380050, And Bounded As Follows:- East-Society Main Road, North-Main Road & Flat No. A/SF/10, West-Flat No. A/SF/12 And South-Block No. C	Rs. 25,61,795.50/- (Rupees Twenty Five Lakh Sixty One Thousand Seven Hundred Ninety Five and Fifty Paise Only)	28-02-2023 24-05-2023

For, further details please contact to Authorised Officer at Branch Office: NeoGrowth Credit Pvt. Ltd. at 505-506, The Link, Vijay Cross Road, Navrangpura, Ahmedabad - 380009, M: +91 9979856644 | Website: www.neogrowth.in Date: 26-05-2023 Sd/-Authorised Officer Place: AHMEDABAD, GUJARAT M/s NeoGrowth Credit Private Limited



Regd. Off. / Factory: 236, Jai Kishan Ind. Estate, B/h. Murlidhar Weigh Bridge, Veraval (Shapar)-360 024. Dist. (Rajkot). Guj. (India). Ph. 02827-252676 Fax: 254371 E-mail: mike@galaxyagrico.com, info@galaxyagrico.com Web: www.galaxyagrico.comCIN:L01110GJ1994PLC21368

(in Lakhs)

EXTRACT OF STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS

FOR THE THREE MONTHS AND YEAR ENDED MARCH 31st, 2023

Particulars	Three Months ended	Three Months ended	Corresponding Three Months ended	Year ended	Year ended
	31-03-2023 (Unaudited)	31-12-2022 (Unaudited)	31-03-2022 (Unaudited)	31-03-2023 (Audited)	31-03-2022 (Audited)
Total income from operations (net)	164.47	167.29	151.04	615.04	723.63
Net Profit / (Loss) for the period (before tax and Exceptional items)	(26.86)	(10.14)	8.73	(53.06)	72.92
Net Profit / (Loss) for the period (before tax and after Exceptional items)	(26.86)	(10.14)	8.73	(53.06)	72.92
Profit / (Loss) for the period after tax (after Exceptional items)	(16.97)	(8.23)	(3.98)	(41.18)	62.52
Total Comprehensive Income for the period ((Comprising profit /(Loss) for the period (after tax) and other comprehensive Income (after tax))	(2.47)	(9.41)	(8.69)	(30.22)	57.81
Equity Share Capital	273.16	273.16	273.16	273.16	273.16
Earnings per share (Rs. 10 per share) (for continuing and discontinued operations) : Basic & Diluted	(0.62)	(0.30)	(0.15)	(1.51)	2.29
	Total income from operations (net) Net Profit / (Loss) for the period (before tax and Exceptional items) Net Profit / (Loss) for the period (before tax and after Exceptional items) Profit / (Loss) for the period after tax (after Exceptional items) Total Comprehensive Income for the period ((Comprising profit /(Loss) for the period (after tax) and other comprehensive Income (after tax)) Equity Share Capital Earnings per share (Rs. 10 per share) (for continuing and discontinued	Particulars Months ended 31-03-2023 (Unaudited) Total income from operations (net) Net Profit / (Loss) for the period (before tax and Exceptional items) Net Profit / (Loss) for the period (before tax and after Exceptional items) Profit / (Loss) for the period after tax (after Exceptional items) Total Comprehensive Income for the period ((Comprising profit /(Loss) for the period (after tax) and other comprehensive Income (after tax)) Equity Share Capital Earnings per share (Rs. 10 per share) (for continuing and discontinued (0.62)	Particulars Months ended 31-03-2023 (Unaudited) Total income from operations (net) Net Profit / (Loss) for the period (before tax and Exceptional items) Net Profit / (Loss) for the period (before tax and after Exceptional items) Profit / (Loss) for the period (the period after tax (after Exceptional items) Total Comprehensive Income for the period ((Comprising profit /(Loss) for the period (after tax) and other comprehensive Income (after tax)) Equity Share Capital Earnings per share (Rs. 10 per share) (for continuing and discontinued) Months ended 31-03-2023 (Unaudited) (10.14) (26.86) (10.14) (26.86) (10.14) (26.87) (2.47) (9.41)	Particulars Months ended 31-03-2023 31-12-2022 31-03-2022 (Unaudited) Total income from operations (net) Net Profit / (Loss) for the period (before tax and Exceptional items) Net Profit / (Loss) for the period (before tax and after Exceptional items) Profit / (Loss) for the period after tax (after Exceptional items) Total Comprehensive Income for the period (after tax) and other comprehensive Income (after tax) Equity Share Capital Earnings per share (Rs. 10 per share) (for continuing and discontinued Three Months ended Months ended 11-12-2022 (Unaudited) 16-202 (Unaudited) 16-203 (10.14) 16-203 (10.	Particulars

Notes to the financial results:

- 1 The above is an extract of the detailed format of Quarterly & Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) at www.bseindia.com and the listed entity at www.galaxyagrico.com
- 2 The Company's financial results for the guarter & year ended 31st March, 2023 have been reviewed by the Audit Committee and subsequently approved & taken on record by the Board of Directors of the Company at its meeting held on 26th May, 2023. These financial results have been extracted from the audited financial statements. Figures for the three months ended March 31, 2023 represent the difference between the audited figures in respect of full financial years and the published figures for the nine months ended December 31, 2022.
- 3 The financial results have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under section 133 of The Companies Act, 2013 and Regulation 33 of SEBI (Listing Obilgation and Disclosure Requirement) Regulation 2015 (as amended) and circulars and notifications issued thereunder.
- 4 Figures of previous reporting periods have been regrouped/reclassified wherever necessary to correspond with the figures of the current reporting period.
- 5 The Company's Operations fall under a single segment "Automotive & Industrial Bearing Rings" . Hence, Segment reporting is not applicable as per Indian Accounting Standard (AS) - 108 Operating Segments.
- 6 The Code on Social Security, 2020 ("the Code") has been enacted, which may impact the employee related contributions made by the Company. The effective date from which the changes are applicable is yet to be notified. The Ministry of Labour and Employment ('the Ministry') has released draft rules for the Code on November 13, 2020. The Company will complete its evaluation and will give appropriate impact in its financial results in the period in which the Code becomes effective and the related rules are published.

 For and on behalf of the Board of Directors,

Date: 26-05-2023

Place: Shapar (Veraval)

Manoj Shah Whole Time Director DIN 02173383

Nathabhai J. Sadaria **Managing Director** DIN -00167254

Service

POSSESSION NOTICE - (for immovable property) Rule 8-(1)

Whereas, the undersigned being the Authorized Officer of IIFL Home Finance Limited (Formerly known as India Infoline Housing Finance Ltd (IIFL HFL) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, a Demand Notice was issued by the Authorised Officer of the company to the borrowers / co-borrowers mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of IFFL HFL for an amount as mentioned herein under with interest thereon. "The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act. If the borrower clears the dues of the "IFFL HFL" together with all costs, charges and expenses incurred, at any time before the date fixed for sale or transfer, the secured assets shall not be sold or ad by "IIFI HFI" and no further step shall be taken by "IIFI HFI" for transfer or sale of the sen ired assets

Name of the Borrower(s)	Description of secured asset (immovable property)	Total Outstanding	Date of	Possession
Palanpur & Mehsana & Modasa & Visnagar BRANCH	All that piece and parcel of: Property No. 1/51/1, With Land	Dues (Rs.)	Demand Notice	
Mr. Desai Kantaben Babubhai. Mrs. Desai Babubhai Versibhai and Mik Income (Prospect No. IL10236495)	Area Ad Measuring 610 Sq.ft., Carpet Area Ad Measuring 481 Sq.ft. and Built Up Area Ad Measuring 602 Sq.ft. Rabari Vas, Gidasan Moti, Vadgam Rural, Gram Panchayat, Vadgam, Gujarat, India, 385120.	Rs. 5,50,833/- (Rupees Five Lakh Fifty Thousand Eight Hundred Thirty Three Only)	24-Feb- 2023	
Mrs. Kunvarben Baldevbhai Rabari and Mr.Baldevbhai Bhalabhai Rabari (Prospect No. 964788)		Rs. 5,91,048/- (Rupees Five Lakh Ninety One Thousand Forty Eight Only)		24-May-23
Mr. Bharatji Pratapaji Gameti. Mrs. Varshaben Bharatji Gameti. & Milk Income (Prospect No. IL10236323)	All that piece and parcel of ; Milkat No. 563, Total Admeasuring 800 sq. ft., Thakarda Vas, Nr. Bus Station, Nr. Meldi Mata Temple, Palanpur-Ambaji Highway, At-Vagdadi, Gram Panchayat, Danta, Ta-Vadgam, Dist-Banaskantha, Gujarat, India, 385120	Rs. 2,53,405/- (Rupees Two Lakh Fifty Three Thousand Four Hundred Five Only)	17-Feb- 2023	24-May-23
Mr. Jashvanikumar Amratlai Danji and Mrs. Komalben Jaswanthhai Danji (Prospect No. 968334)	All that piece and parcel of: Milkat No. 157, With Land Area Ad Measuring 900 Sq.ft. and Carpet Area Ad Measuring 800 Sq.ft., Patel Vas, At-Dhamanva, Visnagar, 384315, Gujarat, India.	Rs. 4,77,024/- (Rupees Four Lakh Seventy Seven Thousand Twenty Four Only)	18-Mar- 2023	24-May-23
Mr. Punjabhai Khembhai Mahida, Mrs. Ushaben Punjabhai Mahida and Punjabhai (Prospect No. IL10162335)	All that piece and parcel of: Plot No.153, With Land Area Ad Measuring 747 Sq.ft. Revenue Survey Number 479, Sarvoday Nagar, Modasa Bazar, Modasa, Modasa, Gujarat, India, 383315.		13-Mar- 2023	23-May-23

Palanpur, Bk (Gujarat) - 385001 and Safal Complex, Mehsana-384002 and F-1 & 2, First Floor, Shree Ram City Centre, Nr. Sbi , Char Rasta Modasa - 383315 and (Ground Floor, Shop no.1,2 and 3, Kalputra Complex, Opposition Viswariath Society, TB Road, Vijaypur 382870). Jor Corporate Office: Plot No.98, Phase-IV, Udyog Vihar, Gurgaon, Haryana Place: Palanpur & Mehsana & Visnagar & Modasa Date: 27/05/2023 Sd/- Authorised Officer, For IIFL Home Finance Limited

INDUSIND BANK LIMITED

Registered Office: 2401, Gen. Thimmayya Road (Cantonment), Pune -411 001. Consumer Finance Division: New No. 34, G.N. Chetty Road, T. Nagar, Chennai - 600 017 State office: 301, 3th Floor, Viva Atlier, Opp. B.D.Patel House, Naranpura, Ahmedabad-380014

POSSESSION NOTICE (Under Rule 8(1) of Security Interest (Enforcement) Rules, 2002)

Whereas, the undersigned being the Authorized Officer of M/s. IndusInd Bank Ltd., under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (hereinafter the said Act) and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002 (hereinafter the said Rules) has issued demand Notice to the below mentioned Borrowers/ Guarantors to repay the amount within 60 days from the date of receipt of the said notice.

The borrower(s) having failed to repay the said amount with further interest within the said period, notice is hereby given to the Borrowers in particular and to the public in general that the undersigned has taken symbolic possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on this date mentioned against the Names of the Borrowers / Guarantors. Any dealings with the said properties shall be subject to the prior charge of M/s. IndusInd Bank Ltd., for the amounts mentioned against the borrowers and incidental expenses, cost, charges and interest thereon. The Borrowers attention is invited to Provisions of Subsection (8) of Sec. 13 of the Act, in respect of the time available to redeem the secured assets.

S. No	Name of Borrower /Guarantor, Loan Agreement No	Demand Notice Date Possession Date	Outstanding Amount	
1.	Borrower: (1) Mr. BHANWARLAL SIRVEE,	25.08.2022	Rs.13,80,094.77/- (Rupe	
	S/o, CHUNILAL SIRVEE Co-borrowers: (2) MS. MOHINI SIRVEE, C/O, DALHARMJI Loan Agreement No. GSG05010M	Possession Date	Thirteen Lakhs Eight Thousand Ninety Four Ar Seventy Seven Paise Only as on 25.08.2022 and furth interest thereon.	

Description of the Mortgaged Property: All the piece and parcel of land and building in Flat No.203, 2nd Floor, admeasuring 34.28 square meters built up area of 737.70 square feet super built up area, along with undivided share in the land of "Shyam Palace of Shivam Residency" situated at Revenue Survey No. 102/1, 102/2, Block No. 104 and 105, Paiki, Plot No. 86, 87, 88, 89 admeasuring 289.52 square meters, Paiki, 273.71 square meters land of Moje Village Kadodara, Taluk: Palsana, District: Surat, Gujarat, and bounded by: East : Open Space: West : Passage, Flat No. 202: North Adj. Building: South: Flat No.204; together with building constructed thereon with all the furniture, fixtures and appurtenance thereto

Borrower: (1) Mr. MAKBUL MOHAMMAD,	25.08.2022	Rs.13,75,104.30/- (Rupees	
C/O. VAKRID Co-borrowers: (2) Mr/Ms. GULSHAN KHATUN, C/O. SHAFAN Loan Agreement No. GSG05015M	Possession Date 24.05.2023	Thirteen Lakhs Seventy-Five Thousand One Hundred Four And Thirty Paise Only) as on 25.08.2022 and further interest thereon.	

Description of the Mortgaged Property: All the piece and parcel of land and building in Plot No.23, admeasuring 48.00 square yard i.e. 40.18 square meters along with 25.29 square meters undivided share in the land of Road and COP, in "S.N. RESIDENCY", situated at Revenue Survey No.408, Old Block No.392, Re-Survey Block No.436, admeasuring He Are 1-33-51 square meters i.e. 13351 square meters in Moje Village: Haldharu, Taluk: Kamrej, District: Surat, Gujarat, having the following four boundaries: On the North : Plot No.22: On the South : Plot No.24; On the East : Society Boundary: On the West: Society Internal Road, together with building constructed thereon with all

	the furniture, fixtures and appurtenance there	nto.			
3.	Borrower: (1) Mr. MUKESH KHANIA,	25.08.2022	Rs.14,47,241.86/- (Rupee		
	S/O, JAGDISH KHANIA Co-borrowers: (2) Mr. RAHUL MUKESH KHANIA, S/O, JAGDISH KHANIA Co-borrowers: (3) MS, MANISHA BHART BUTIYA Guarantor: (4) MR. RANVIJAY RAJPUT, C/O, SRI KRISHA SINGH	Possession Date 24.05.2023	Fourteen Lakhs Forty-Seven Thousand Two Hundred Forty- One And Eighty Six Paise Only) as on 25.08.2022 and further interest thereon.		

Loan Agreement No. GSG05037M Description of the Mortgaged Property: All the piece and parcel of land and building in the Plot No.282, as per site admeasuring 48.00 square yards i.e. 40.15 square meters as per passing plan admeasuring 33.13 square meters along with 23.42 square meters undivided share in the land of Road and COP in "SHREE KAMADHEU RESIDENCY" situated at Revenue Survey No.516, Block No.511, New Block No.550 of Mouje Village Pipodara, Taluka: Mangrol, District: Surat, Gujarat,

	which is bounded as under: North: Plot No.283; South: Plot No.281; East: Society Road; West: Pl No.295; together with building constructed thereon with all the furniture, fixtures and appurtenant thereto.						
4.	Borrower: (1) Mr. MAHESH NARBHERAM	04.11.2022	Rs.12,25,119.74/-(Rupe				
	PARMAR, S/o NARBHERAM Co-borrowers: (2) Mr. JAGRUTIBEN MAHESHBHAL, S/o ARUNBHAI	Possession Date 24.05.2023	Twelve Lakhs Twenty Fi Thousand One Hundre Nineteen And Seventy Fo				

Loan Agreement No. GRM05026M,

Description of the Mortgaged Property: All the piece and parcel of land and building in Residential property being a House constructed on land measuring 38.27 square meters area known as "Gaurag Sheri" of City Survey Ward No.1 of Sheet No.176, Chal No.358 and Revenue Survey No.1315 Paiki of Mouje Morbi, Taluk Morbi, District and Sub-District Morbi and bounded by: East: Ra Street: West Darbari Space, Vareru: North : Others Property; South : Others Property; together with building

Paise Only), as on 28.10.2022

and further interest thereon.

	constructed over the said site along with furniti	irtenance thereto.	
	Borrower: (1) Mr./Mrs./Ms. BHARATBHAI CHAUHAN, C/o. MOTIBHAI, Co-borrowers: (2) Mr./Mrs./Ms. RAMILABEN CHAUHAN, C/o. LABHUBHAI Loan Agreement No. GRM05070M		Rs.1014671.12 (Ten Lakh Fourteen Thousand Six Hundred Seventy One Rupees And Twelve Paisa Only) as on 20.12.2022 and further interest
		Possession Date 24.05.2023	

Description of the Mortgaged Property: All the piece and parcel of land and building at residential property bearing Flat No. 305, built up area 67.07 sq. mtrs., at Third Floor of Building known as Mahi Apartment constructed on Land admeasuring 455.40 sq. mtrs. of Plot No.17 of Revenue Survey No.115/1 Paiki of Mouje: Bhadiyad, Tal: Morbi, District and Sub-District: Morbi, and bounded as under: North: Foyer and Stair; South: OTS and Plot No.21; East: Flat No.306; West: Lift, OTS and Flat No.304; together with building constructed over the said site along with furniture, fixtures and appurtenance thereto.

Borrower: (1) Mr/Mrs. MILANBHAI	29.04.2022	Rs.1609040.68 (Sixteen Lakh
ODHAVJIBHAI, C/o. ODHAVJIBHAI Co-borrowers: (2) Mr/Mrs. LATABEN MILANBHAI MODHA, C/o. TIRATHDAS Loan Agreement No. GRR05106M	Possession Date 23.05.2023	Nine Thousand Forty Rupees And Sotty Eight Paisa Only) as on 28.04.2022 and further interest thereon

Description of the Mortgaged Property: All the piece and parcel of land and building at Flat No. 104 of 50-07 Sq.mt built up area on 1st floor Tower- B in Building called "Oskar Enclave" over land measured 3562-00 Sq.mt of plot No. 1, Situated at Rajkot R.S No. 598 (P) 4, T.P No. 23, F.P No. 14/1, City Survey Ward No.18, City Survey No.38/C/1/1, Tal. Dist. Rajkot. Four Boundaries of the Property: North: Flat No. A/104; South: Flat No. B/103; East: Margin Space; West: Entrance for this flat and passage; together with building constructed over the said site along with furniture, fixtures and

apportenance triereto.		
Borrower: (1) Mr. DHADUK KISHANKUMAR BABUBHAI, S/o,	25.08.2022	Rs.25,20,979.31/- (Rupees
BABUBHAI Co-borrowers: (2) Ms. DHADUK RAMILABEN BABUBHAI, S/o, VIRJIBHAI	Possession Date Thousan K 24.05.2023 Seventy I	Twenty Five Lakhs Twenty Thousand Nine Hundred Seventy Nine And Thirty One Paise Only) as on 25.08.2022

Loan Agreement No. GSS05064M

Description of the Mortgaged Property: All the piece and parcel of land and building in the property Plot No.86 as per booking admeasuring 70.80 square yards as per passing plan admeasuring 54.44 square meters, along with 34.21 square meters Undivided Share in the land of Road and COP in 'Ever Villa Row House' situated at Revenue Survey No.117/1, Block No.211 admeasuring Hec. Are 1-31-52 square meters, i.e. 13152 square meters, Akar 15-87 Paisa of Mouje Village Sayan, Taluk Olpad, District Surat, Guiarat having the following four boundaries: On the North Society Road; On the South: Block No.210, On the East: Plot No.85; On the West: Society Road; together with building constructed thereon with all the furniture, fixtures and appurtenance thereto.

	Borrower: (1) Mr. PRAMODKUMAR	25.08.2022	Rs.10,14,249.52/- (Rupees Ten		
	SANICHAR, S/o, SANICHAR Co-borrowers: (2) Ms. KAUSHLYA DEVI, D/W/o, SANICHAR Guarantor: (3) Mr. RAM SAJIVAN, D/W/o, HORILAL Loan Agreement No. GSS05136M	Possession Date 24.05.2023	Lakhs Fourteen Thousand Two Hundred Forty Nine And Fifty Two Paise Only) as on 25.08.2022 and further interest thereon		

Description of the Mortgaged Property: All the piece and parcel of land and building in the property being Flat No.107 admeasuring about 552 square feet i.e. 51.28 square meters super built up area and admeasuring 28.39 square meters built up area on 1st Floor along with undivided proportionate share in the land in the scheme known as SHIVALIK RESIDENCY in SHIVAM RESIDENCY forming part of land bearing Revenue Survey No.102/1, 102/2 Block No.104 and 105 Paikee Plot No. 138 to 141 of Mouje Kadodara, Palasana Taluka, in the Registration District and Sub-District of Surat, which is bounded as under: North : Adj. Flat No. 108; South : Adj. Entry Gate; East : Adi. Passage; West: Adi. Society Road; together with building constructed thereon with all the

furniture, fixtures and appurtenance thereto. Date: 23.05.2023, 24.05.2023 For IndusInd Bank Limited,

Place: Rajkot and Surat (Authorized Officer)

Ahmedabad

financialexp.epapr.in

Than Road; South: Plot No.11/1;

Date: - 27-05-2023 Place: - Rajkot